

વહાલા માતાપિતા અને સંભાળ રાખનારા કેરર્સ,

મને ખુશી છે કે આ અઠવાડિયે અમે વિદ્યાર્થીઓને ભણતરના સ્થાને ફરીથી આવવાનું સ્વાગત કરી શકીએ છીએ. ભણવાના સ્થાને શિક્ષણ મેળવવું અગત્યનું છે, ફક્ત શીખવા માટે નહિ પણ આપણા બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે પણ.

સ્કુલમાં ફરી પાછા આવવા માટેની વધુ માહિતી માટે અમારું વેબ પેજ જુઓ [School arrangements - back to school \(COVID-19\) \(leicester.gov.uk\)](https://www.leicester.gov.uk/school-arrangements-back-to-school-covid-19/).

હું તમને એ યાદ કરાવવા યાદીશ કે બાળકો માટે સ્કુલ્સ ખુલ્લી હોય ત્યાં સુધી આપણે હજી પણ રાષ્ટ્રિય માર્ગદર્શનનું પાલન કરવું પડશે. આ પાબંધીઓ તમારી અને તમારા વહાલાઓની સુરક્ષા માટે તેમજ કોરોનાવાઇરસના ફેલાવાને ઘટાડવા માટે મુકવામાં આવી છે.

- તમે જેની સાથે રહેતા ના હોય તેઓ સાથે ઘરમાં હળીમળી ના શકો, તેમાં જન્મદિવસની પાર્ટી અને બાળકોને સાથે રમવા માટેની પ્લે ડેટ્સ વગેરેનો પણ સમાવેશ થાય છે.
- તમે બીજા ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિને મળી શકો અને તે બહારના સ્થળે હોવું જોઈએ.

ઉપરની બાબતો મુખ્ય જનતા આરોગ્ય સલાહ (પબ્લિક હેલ્થ એડવાઇસ) ની ઉપરાંત છે, જેમાં તમારા હાથ અવારનવાર ધોવાનું, જ્યારે જરૂરી હોય ત્યારે મોઢાં પર ઢાંકણ પહેરવાનું તેમજ સામાજિક દુરી પાળવાની; આપણે બધાએ શક્ય એટલું ઘરમાં જ રહેવું જરૂરી છે.

ગવર્નમેન્ટ રોડમેપ (સરકારનો આગળ વધવા માટેનો માર્ગ નકશો) તેમજ નિર્દેશિત તારીખો જોવા માટે સરકારી વેબસાઇટ જુઓ [COVID-19 Response - Spring 2021 - GOV.UK \(www.gov.uk\)](https://www.gov.uk/covid-19-response-spring-2021)

કૃપિયા એ યાદ રાખશો કે આ તારીખો મુકરર (ફિક્સ) નથી કરાઈ અને જો કોરોનાવાઇરસની પરિસ્થિતિમાં બદલાવ ના આવે અથવા વધુ ખરાબ થાય તો તે તારીખોને બદલાવી પણ શકાય.

હાલ સુધી આ માર્ગદર્શનનું પાલન કરવા બદલ હું આપનો આભાર માનું છું. હું જાણું છું કે આપણા કોઇ માટે સહેલું નથી અને આપણે બધાને ફરીથી ફક્ત એક સાધારણ જીવન જીવવાનું જોઈએ છે. જો આપણે આ માર્ગદર્શનનું પાલન કરવાનું ચાલુ રાખશું અને થોડા વધારે સમય માટે જો હળવા-મળવાનું બંધ રાખશું તો એક સાધારણ ઉનાળા (સમર) માટેની આપણી આશાઓ પુરી થઈ શકે એમ છે.

આપનો સન્નદયિ

આઇવન બ્રાઉન, ડાયરેક્ટર ઓફ પબ્લિક હેલ્થ, લેસ્ટર સિટી કાઉન્સિલ

Ivan Browne, Director of Public Health, Leicester City Council